

[5/A-4G] Seat No: _____

No. of printed pages: 03

SARDAR PATEL UNIVERSITY
BCom (III - Semester) (2010 Batch) Examination
Saturday, 24th November 2018
10.00 am - 12.00 pm
UB03CCOM02 - Fundamentals of Cost Accounting

કુલ ગુણ : ૬૦

નોંધ: જમણી બાજુના અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

પ્ર.૧ પડતર હિસાબી પદ્ધતિ એટલે શું ? પડતર હિસાબી પદ્ધતિના લાભો અને મર્યાદાઓ વર્ણવો. (૧૫)

અથવા

પ્ર.૧

(અ) પડતર હિસાબી પદ્ધતિ અને નાણાંકીય હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવત વર્ણવો. (૦૮)

(બ) વર્ણવો: પડતરની પદ્ધતિઓ. (૦૭)

પ્ર.૨

(અ) મજૂર ફેરબદલીના કારણો કયા છે ? તેના ઉપાયો ચર્ચો. (૦૮)

(બ) નીચેની માહિતી પરથી ગણતરી કરો. (૦૭)

(૧) પુનઃ વરદી સપાટી

(૨) લઘુત્તમ સપાટી

(૩) સરેરાશ સ્ટોક સપાટી

(૪) ગુરુત્તમ સપાટી

(૫) ભય સપાટી

માહિતી :

(૧) માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય - ૬૦ દિવસ.

(૨) માલ મેળવતા લાગતો સરેરાશ સમય - ૪૦ દિવસ.

(૩) તાત્કાલિક માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય - ૮ દિવસ.

(૪) વધુમાં વધુ દૈનિક વપરાશ ૪૫ એકમો.

(૫) ઓછામાં ઓછો દૈનિક વપરાશ ૨૫ એકમો.

(૬) વરદી જથ્થો ૮૦૦ એકમો.

અથવા

પ્ર.૨

(અ) માલસામાનના પ્રકારો પર ટૂંકનોંધ લખો. (૦૫)

(બ) એક કામદારને કાર્ય પુરું કરવા માટે ૩૦ કલાક આપવામાં આવે છે. પરંતુ તે કાર્ય ૨૧ કલાકમાં પૂર્ણ કરે છે. (૧૦)
તેને કલાકના રૂ. ૭૫ના દરથી વેતન ચૂકવવામાં આવે છે.

વેતન શોધો:

(૧) સમય વેતન પદ્ધતિ મુજબ

(૨) કાર્ય વેતન પદ્ધતિ મુજબ

(૩) હેલ્સી યોજના મુજબ

(૪) રોવેન યોજના મુજબ